

28th October, 2024

To,
BSE Limited
Listing Dept. / Dept. of Corporate Services,
Phiroze Jeejeebhoy Towers,
Dalal Street, Mumbai - 400 001.

To,
National Stock Exchange of India Limited
Listing Dept., Exchange Plaza, 5th Floor,
Plot No. C/1, G. Block, Bandra-Kurla Complex,
Bandra (E), Mumbai - 400 051.

Security Code: 539301
Security ID : ARVSMART

Symbol: ARVSMART

Sub: Submission of newspaper advertisement in respect of Postal Ballot Notice and Remote e-Voting.

Pursuant to Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we enclose herewith the copies of the newspaper advertisement published on 26th October, 2024 in the Financial Express (In English - All India edition and in Gujarati - Ahmedabad Edition) in respect of Postal Ballot Notice and Remote e-Voting information.

You are requested to take note of the same.

Thanking you,
Yours faithfully,
For Arvind SmartSpaces Limited

Prakash Makwana
Company Secretary

Encl.: As above

#DESIGNEDTOINSPIRE

Arvind Smartspaces Limited :

Regd. Office: 24, Government Servant Society, Near Municipal Market, Off C.G. Road, Navrangpura, Ahmedabad. 380009, India.
Tel. : +91 79 68267000 | **Web.:** www.arvindsmartspaces.com | **CIN :** L45201GJ2008PLC055771

COAL INDIA LIMITED
A MAHARATNA COMPANY
Coal Division, Core-2, 3rd Floor, Premises No. 41 MAR, Plot No. AF-11,
Action Area 'A', New Town, Rajarat, Kolkata 700015.
Phone: 033-22462528
Email - clt.tadoc@coalindia.in, Website: www.coalindia.in
IN - L2199WB173G028344

Sub: Tax on 1st Interim Dividend for FY 2024-25
Board of Directors of Coal India Limited at their meeting held on 25th Oct 2024 has inter-alia decided the payment of 1st Interim Dividend @ Rs. 16.75 per equity share having face value of Rs. 10/- each for the FY 2024-25. This communication is in respect of the applicable Tax Deduction at Source (TDS) provisions as per the Income Tax Act 1961 on the dividend payable by Coal India Limited. Detailed requirements for various categories of shareholders seeking exemption from TDS are uploaded on the website of Coal India Limited under Investor Center Tab which may be referred by the shareholders.

The dividend, as declared by the Board, will be paid to shareholders holding equity shares of the Company, whether in electronic or in physical form on **Tuesday, 5th Nov 2024, i.e. Record Date**.

Shareholders who wish to avail the benefit of nil / lower / beneficial deduction of tax at source are requested to fill up the relevant forms and mail to clt.tadoc@coalindia.in on or before Thursday, 7th Nov 2024 (cut-off date).

Kindly note that exemptions from tax at source are available to any other email/s of the portfoli / Register and Share Transfer Agent will not be considered. Further, application of nil / lower / beneficial tax rate shall depend upon the completeness of documents submitted by the shareholders and review to the satisfaction by the company.

For Coal India Limited
Sd/-
B.P. Dubey
Company Secretary & Compliance Officer

Place: Kolkata
Date: 25.10.2024

For Advertising in
TENDER PAGES
Contact
JITENDRA PATIL
Mobile No.: 9029012015
Landline No.: 67440215

GO COLORS!
GO FASHION (INDIA) LIMITED
CIN: L17291TN2010PLC007303
Registered Office: No. 43/20, Nungambakkam High Road, Nungambakkam, Chennai, Tamil Nadu 600 094
Website: www.go-fashions.com

EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND SIX MONTHS ENDED SEPTEMBER 30, 2024
(All in Lakhs, except Earnings Per Share data, unless otherwise stated)

Particulars	Quarter ended	Six months ended	Quarter ended
	30.09.2024 (Unaudited)	30.09.2023 (Unaudited)	31.03.2024 (Unaudited)
1 Total Income from Operations	20,853.36	42,862.73	18,885.05
2 Net Profit / (Loss) for the period (before Tax, Exceptional Items)	2,819.44	6,562.33	2,576.58
3 Net Profit / (Loss) for the period before tax (after Exceptional Items)	2,819.44	6,562.33	2,576.58
4 Net Profit / (Loss) for the period after tax (after Exceptional Items)	2,063.32	4,928.35	2,004.17
5 Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	2,000.09	4,961.91	1,981.15
6 Paid-up Equity Share Capital (Face value of ₹10 each)	5,400.90	5,400.90	5,400.90
7 Other Equity (excluding Retention Reserve) as shown in the Audited Balance Sheet of the previous year			
8 Earnings Per Share (₹10/- each) (for continuing and discontinued operations):			
1. Basic	3.83	9.13	3.71
2. Diluted	3.83	9.13	3.71

Note:
The above is an extract of the detailed format of Quarterly and Six months Unaudited Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosures Requirements) Regulations, 2015. The full format of the Quarterly and Six months Unaudited Financial Results are available on the websites of the Stock Exchanges (www.nseindia.com and www.bseindia.com) and on Company's website (www.go-fashions.com). The financial results have been duly approved by the Board of Directors at their meeting held on October 25, 2024.

Place: Chennai
Date: October 25, 2024

For Go Fashion (India) Limited
Prakash Kumar Sarangi
Managing Director
DIN No: 00496252

VASTU FINSERVE INDIA PRIVATE LIMITED
Registered Office: 203/204 A/Wing, 2nd Floor, Hebbalharal Estates,
Zakaria Bunder Road, Sewri (West), Mumbai 400 015.
CIN: U65990MH2018PTC1453576022419911 | Website: www.vastufinserve.com

EXTRACT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED SEPTEMBER 30, 2024 (₹ in lakhs)

Sr. No.	Particulars	Quarter ended	Quarter ended	Half Year ended	Year ended
		30.09.2024 (Audited)	30.09.2023 (Audited)	30.09.2024 (Audited)	31.03.2024 (Audited)
1	Total income from operations	8,246.99	5,400.00	15,153.36	23,941.92
2	Net profit/(loss) for the period (before tax, exceptional and/or extraordinary items)	524.84	728.92	836.41	4,463.16
3	Net profit/(loss) for the period before tax (after exceptional and/or extraordinary items)	524.84	728.92	836.41	4,463.16
4	Net profit/(loss) for the period after tax (after exceptional and/or extraordinary items)	443.91	748.38	690.57	2,879.89
5	Total comprehensive income for the period (comprising profit/(loss) for the period (after tax) and other comprehensive income (after tax))	441.54	748.38	686.66	2,868.66
6	Paid-up equity share capital	15,590.01	12,630.29	15,590.01	14,854.71
7	Reserves (excluding revaluation reserves)	4,540.45	2,588.08	4,540.45	3,853.79
8	Securities premium account	39,406.79	22,368.50	39,406.79	35,144.08
9	Net worth	59,538.25	37,586.87	59,538.25	53,852.58
10	Paid up debt capital/outstanding debt	1,28,778.38	1,11,498.41	1,28,778.38	1,26,746.56
11	Outstanding redeemable preference shares				
12	Debt equity ratio	2.16	2.97	2.16	2.35
13	Earnings per share (₹10/- each) (for continuing and discontinued operations)				
	Basic EPS (in ₹) (*not annualised)	0.28*	0.59*	0.45*	2.26
	Diluted EPS (in ₹) (*not annualised)	0.28*	0.59*	0.45*	2.26
14	Capital redemption reserve	N.A.	N.A.	N.A.	N.A.
15	Debenture redemption reserve	N.A.	N.A.	N.A.	N.A.
16	Debt service coverage ratio	N.A.	N.A.	N.A.	N.A.
17	Interest service coverage ratio	N.A.	N.A.	N.A.	N.A.

Notes:
a) The above is an extract of the detailed format of audited quarter and half year ended financial results filed with the BSE Limited under Regulation 52 of the SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015. The full format of the audited quarter and half year ended financial results are available on the websites of BSE Limited and the Company at www.bseindia.com and www.vastufinserve.com respectively.
b) For the other line items referred in regulation 52 (4) of the SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015, pertinent disclosures have been made to the BSE Limited and can be accessed at www.bseindia.com. The additional disclosures applicable to the Company under Regulation 52(4) of SEBI LODR are stated below:
Sr. No. Particulars Quarter ended September 30, 2024 Half year ended September 30, 2024

1	Total debts to total assets	N.A.	67.09%
2	Operating margin (%)	6.37%	5.52%
3	Net profit margin (%)	5.38%	4.56%
4	Gross NPA (%)	N.A.	3.51%
5	Net NPA (%)	N.A.	1.91%
6	Liquidity coverage ratio	N.A.	1455.71%
7	Provision coverage ratio	N.A.	83.46%
8	Security cover (debt) (no. of times)	N.A.	1.12

c) Figures of the previous period/year have been regrouped/reclassified wherever necessary to conform to current period's classification/disclosure.

For Vastu Finserve India Private Limited
Sd/-
Sandeep Menon
Whole Time Director
(DIN: 02302154)

CREDITACCESS GREENE LIMITED
Regd. & Corp. Office: No. 49, 49th Cross, 8th Block, Jayanagar,
(Next to Rajalakshmi Kalyana Mantap) Bengaluru KA-560070 IN
Website: www.creditaccessgreen.com
CIN: L51216KA1991PLC053425

Unaudited Consolidated Financial Result for the Quarter and Half year ended September 30, 2024 (₹ in Crores)

Sl. No.	Particulars	Quarter ended	Half year ended	Quarter ended	Year ended
		Sept. 30, 2024 (Unaudited)	Sept. 30, 2024 (Unaudited)	Sept. 30, 2023 (Unaudited)	March 31, 2024 (Audited)
1	Total Income from Operations	1,453.92	2,966.50	1,247.59	5,172.65
2	Net Profit for the period before Tax, Exceptional and/or Extraordinary Items	251.99	786.73	466.77	1,939.18
3	Net Profit for the period before Tax and after Exceptional and/or Extraordinary Items	251.99	786.73	466.77	1,939.18
4	Net Profit for the period after Tax, Exceptional and/or Extraordinary Items	186.06	583.72	347.04	1,445.93
5	Total Comprehensive Profit/ (Loss) for the period (Comprising Profit/ (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	178.12	561.26	342.01	1,431.24
6	Paid-up Equity Share Capital	159.46	159.46	159.11	159.38
7	Reserves excluding Revaluation Reserves	4,325.56	4,325.56	3,154.40	3,912.47
8	Securities Premium Account	2,503.39	2,503.39	2,484.23	2,498.13
9	Net worth	6,988.41	6,988.41	5,797.74	6,569.98
10	Outstanding Redeemable Preference Shares	Nil	Nil	Nil	Nil
11	Debt Equity Ratio	2.74	2.74	3.05	3.32
12	Paid-up Debt Capital/Outstanding Debt	19,153.67	19,153.67	17,668.56	21,841.01
13	Earnings Per Share (Face value ₹10 per share) (for continuing and discontinued operations)				
	- Basic (₹)	11.67	36.62	21.82	90.88
	- Diluted (₹)	11.61	36.43	21.69	90.41
14	Capital Redemption Reserve	Nil	Nil	Nil	Nil
15	Debenture Redemption Reserve	Nil	Nil	Nil	Nil
16	Debt Service Coverage Ratio	Not Applicable	Not Applicable	Not Applicable	Not Applicable
17	Interest Service Coverage Ratio	Not Applicable	Not Applicable	Not Applicable	Not Applicable

Notes:
1) The above financial Results were reviewed by the Audit Committee and thereafter approved and taken on record by the Board of Directors at their respective meetings held on October 25, 2024. The Joint Statutory Auditors have expressed an unmodified opinion on the both Standalone and Consolidated financial statements for the year.
2) Standalone Total Income from operations: ₹ 1,453.92 Cr/- and ₹ 2,966.50 Cr/-; (b) Net profit before tax: ₹ 251.99 Cr/- and ₹ 786.73 Cr/-; and (c) Net profit after tax: ₹ 186.06 Cr/- and ₹ 583.72 Cr/- for the quarter and half year ended respectively.
3) The above is an extract of the detailed format of Unaudited Financial Results filed with the Stock Exchanges under Regulation 33 and 52 of the SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015. The full format of the unaudited financial results are available on the websites of National Stock Exchange of India at www.nseindia.com, BSE Limited at www.bseindia.com and on the Company's website at www.creditaccessgreen.com.
4) For the other line items referred in regulation 52(4) of the amended Listing Regulations, pertinent disclosures have been made to the Stock Exchange (g) and can be accessed through the website link given in point no.3 above.

For and on behalf of the Board of CreditAccess Greene Limited
Sd/-
Udaya Kumar Hebbur
Managing Director

Date: October 25, 2024
Place: Bengaluru

CLASSIFIED CENTRES IN MUMBAI

NAC
NAC (P)
Mobile: 9644132558

Rickon
Rickon (P)
Mobile: 9867445557

Space Age Advertising
Space Age Advertising (P)
Phone: 26552307
Mobile: 9820921933

Kirit Agencies
Kirit (P)
Phone: 26074242
Hindustan Advertising
Hindustan Advertising (P)
Phone: 26404229

Premiere
Premiere (P)
Mobile: 982778766

Vivante
Vivante (P)
Phone: 64226000

Ampla Media
Ampla Media (P)
Mobile: 9815298703

Ranbay Publicity
Ranbay Publicity (P)
Mobile: 987970542

Carl Advertising
Carl Advertising (P)
Phone: 66963441 / 42

Grant Price Communication
Grant Price Communication (P)
Mobile: 9820960562 / 9820960568

Amya Publicity
Amya Publicity (P)
Phone: 26255077
Mobile: 9820921933

Loknandan Advertising
Loknandan Advertising (P)
Mobile: 26362274 / 26316066

Multimedia Informatics
Multimedia Informatics (P)
Mobile: 825801339

Prime Publicity Services
Prime Publicity Services (P)
Phone: 26393866 / 26383034

Zeus Creation
Zeus Creation (P)
Phone: 022-26288794
Mobile: 9820921933 / 9820199918

P. V. Advertising
P. V. Advertising (P)
Mobile: 26758188
Mobile: 9812012300

Naha Agency
Naha Agency (P)
Phone: 26275043
Mobile: 9819909621

CSF
CSF (P)
Mobile: 9854020091

Shard Enterprise
Shard Enterprise (P)
Phone: 26366587

Adviser Services
Adviser Services (P)
Phone: 26762157 / 26724291

Sumartha Advertiser Pvt. Ltd.
Sumartha Advertiser Pvt. Ltd. (P)
Phone: 26421294
Mobile: 959496927

Targat Media
Targat Media (P)
Mobile: 982929646 / 97620711

Scrum Advertising
Scrum Advertising (P)
Mobile: 9820921933

Big Fish Media
Big Fish Media (P)
Mobile: 9812720887
Mobile: 9322265712

PRAJ INDUSTRIES LIMITED
CIN: L27101PN1985PLC038031
Regd. Office: "PRAJ TOWER", S. No. 274 & 275/2,
BHUMKAR CHOWK - HINJEWADI ROAD, HINJEWADI, PUNE - 411 057

EXTRACT OF STATEMENT OF CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED 30 SEPTEMBER 2024. (Rupees in million except per share data)

Sr. No.	Particulars	Quarter ended	Half Year ended	Quarter ended
		30 September 2024 (Unaudited)	30 September 2024 (Unaudited)	30 September 2023 (Unaudited)
1	Revenue from operations	8,161.920	15,153.334	8,823.685
2	Net profit for the period (before tax and exceptional items)	744.419	1,533.224	848.121
3	Net profit for the period (before tax and after exceptional items)	744.419	1,814.796	848.121
4	Net profit for the period after tax	538.310	1,380.117	623.679
5	Total comprehensive income for the period (comprising profit for the period (after tax) and other comprehensive income (after tax))	515.774	1,352.651	587.940
6	Paid up equity share capital (Face value Rs.2/- each)	367.626	367.626	367.426
7	Earnings per share (of Rs. 2/- each)			
	1. Basic (not annualised)	2.93	7.51	3.40
	2. Diluted (not annualised)	2.93	7.51	3.40

Notes:
1) The above results were reviewed by the Audit Committee on 25 Oct 2024 and approved by the Board of Directors on 25 Oct 2024.
2) The group operates only in one segment, i.e. "Process and Project Engineering".
3) Exceptional Item consists of profit on sale of land located at Nasarapur, which was classified as "Asset held for sale" as on 31 March 2024.
4) The Standalone unaudited financial results for the quarter and half year ended on 30 September 2024 are summarized below:

Sr. No.	Particulars	Quarter ended 30 September 2024 (Unaudited)	Half Year ended 30 September 2024 (Unaudited)	Quarter ended 30 September 2023 (Unaudited)
a	Revenue from operations	7,035.104	13,041.713	7,832.629
b	Net profit for the period after tax	578.758	1,497.159	841.332
c	Total comprehensive income for the period (comprising profit for the period (after tax) and other comprehensive income (after tax))	551.442	1,466.176	810.760
d	Earnings per share (of Rs. 2/- each)			
	1. Basic (not annualised)	3.15	8.15	4.58
	2. Diluted (not annualised)	3.15	8.15	4.57

5) The above is an extract of the detailed format of Financial Results for the quarter and half year ended on 30 September 2024 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015 and SEBI circular no. CIR/CFD/FAC/62/2016 dated 5th July 2016. The full format of the Financial Results is available on the Stock Exchange websites at www.nseindia.com and www.bseindia.com and on the Company's website at www.praj.net

Place: Pune
Date: 25 OCT 2024

SHISHIR JOSHI PURA
CEO AND MANAGING DIRECTOR
DIN: 00574970

ARVIND SMARTSPACES LIMITED
Regd. Off: 24, Government Servants Society, Near Municipal Market, Off. C. G. Road, Navrangpura, Ahmedabad-380009. Tel: +91 7968270000. Email: investor@arvindinfra.com Website: www.arvindsmartspace.com

NOTICE OF POSTAL BALLOT

Notice is hereby given, pursuant to the provisions of Section 110 of the Companies Act, 2013 (the Act) read with Rules 20 and 22 of the Companies (Management and Administration) Rules, 2014 (the Rules), the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015 (SEBI LODR Regulations), General Circular No. 14/2020 dated 8th April, 2020, 17/2020 dated 13th April, 2020, 22/2020 dated 16th June, 2020, 33/2020 dated 28th September, 2020, 39/2020 dated 31st December, 2020, 10/2021 dated 23rd June, 2021, 20/2021 dated 8th December, 2021, 3/2022 dated 5th May, 2022, 11/2022 dated 28th December, 2022, 09/2023 dated 25th September, 2023 and 09/2024 dated 19th September, 2024, issued by Ministry of Corporate Affairs ("MCA Circulars") that the Company is seeking approval of members for the special business as set out in the Postal Ballot Notice dated 25th October, 2024 ("Postal Ballot Notice"). Members are informed that the Postal Ballot Notice along with relevant Explanatory Statement and voting instructions for remote e-voting have been sent to members who have registered their email addresses with the Company or Depository Participant(s) on their registered e-mail addresses as on the cut-off date.

The Postal Ballot Notice has been sent to members whose names appear in the Register of Members / List of Beneficial Owners as received from the National Securities Depository Limited (NSDL) and Central Depository Services (India) Limited (CDSL) as on Friday, 18th October, 2024 (the "Cut - Off Date"). The voting rights shall be reckoned on the paid-up value of the shares registered in the name of members in the Cut - Off Date. A person who is not a member as on the Cut - Off Date should treat this notice for information purpose only.

Members should note that in terms of the MCA Circulars, no physical ballot form is being dispatched by the Company and the Members can cast their vote using remote e-voting facility only.

Pursuant to the MCA Circulars, Members whose email addresses were not registered with the Company or Depository Participant(s) as on the Cut - Off Date, are requested to re-iter their email addresses by sending an email citing subject line as "ASL-Postal Ballot-Registration of e-mail Ids" to our RTA i.e. Link Intime India Private Limited at ahmedabad@linkintime.co.in or to the Company at investor@arvindinfra.com with name of registered shareholder(s), folio number(s) / DP Id(s) / Client Id(s) and No. of shares held from the email address they wish to register to enable them to exercise their vote(s) on the special business as set out in the Postal Ballot Notice through remote e-voting facility provided by NSDL. For details of the process of casting vote through remote e-voting by the members holding shares in physical form or who have not registered their email addresses with the Company or Depository Participant(s), members are requested to refer instruction no. 7 of the Postal Ballot Notice.

In accordance with the provisions of Section 108 of the Act read with the Rules, the MCA Circulars and Regulation 44 of the SEBI LODR Regulations, the Company is providing facility by its members to exercise their votes electronically in respect of item enlisted in the Postal Ballot Notice through the remote e-voting facility provided by NSDL.

Details of Postal Ballot Schedule:

Sr. No.	Particulars	Schedule
1	Date of Completion of dispatch of postal ballot notice	Friday, 25th October, 2024
2	Cut - off date for identification of voting rights of the members	Friday, 18th October, 2024
3	Date and time of commencement of remote e-voting	Sunday, 27th October, 2024 (09:00 a.m.)
4	Date and time of end of remote e-voting	Monday, 25th November, 2024 (05:00 p.m.)
5	Remote e-voting shall not be allowed beyond	Monday, 25th November, 2024 (05:00 p.m.)
6	Scrutinizer	Mr. Hitesh Buch, Practising Company Secretary (CP No.8195)
7	Contact details of the person at NSDL responsible to address the grievances connected to e-voting	Ms. Pallavi Mahtra, Manager, email: evoting@nsdl.com or call on 022 - 4886 7000

Members are informed that: (1) Members can vote only through remote e-voting facility provided by NSDL as no physical ballot form is being dispatched or will be accepted by the Company. (2) A member who has not received Postal Ballot Notice on their registered email address along with relevant Explanatory Statement and e-voting instructions for remote e-voting may obtain the same by sending an email to our RTA i.e. Link Intime India Private Limited at ahmedabad@linkintime.co.in or to the Company at investor@arvindinfra.com. (3) A copy of the Postal Ballot Notice and the procedure for registration of email addresses of members are also available on the website of the Company at www.arvindsmartspace.com. The Postal Ballot Notice along with Explanatory Statement is also available on website of BSE Limited (www.bseindia.com) and National Stock Exchange of India Limited (www.nseindia.com) ("Stock Exchanges" where the equity shares of the Company are listed), (4) Ms. Hitesh Buch, Practising Company Secretary, (CP No.8195) has been appointed as Scrutinizer for conducting remote e-voting process in accordance with the law and the terms and conditions of the Explanatory Statement and the Explanatory Statement, in relation to voting through electronic means, members may contact Registrar and Transfer Agent (RTA) i.e. Link Intime India Private Limited at ahmedabad@linkintime.co.in, the Scrutinizer at pcs.buchassociates@gmail.com or the Company at investor@arvindinfra.com. (5) The result of the voting by Postal Ballot shall be declared on or before Tuesday, 26th November, 2024. The result declared and the Scrutinizer's Report shall be made available at the Registered Office of the Company and on the Company's website and on the website of NSDL at www.evoting.nsdl.com besides being communicated to the Stock Exchanges where the Company's shares are listed.

For Arvind SmartSpaces Limited
Sd/-
Prakash Makwana
Company Secretary

Place: Ahmedabad
Date: 25th October, 2024

